



**“नेशनल मिशन ओन ओइलसीड्स એન્ડ ઓઇલપામ”**  
**પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે**  
**આયોજિત તાલીમ કાર્યક્રમ**



કૃષિ મંત્રાલય, ભારત સરકાર હસ્તક પ્રોજેક્ટ “નેશનલ મિશન ઓન ઓઇલસીડ્સ એન્ડ ઓઇલ પામ (NMOOP), અંતર્ગત તા: ૧૭-૧૦-૨૦૧૬ થી ૧૮-૧૦-૨૦૧૬ દરમ્યાન ખેતીવાડી વિભાગ, મહેમદાવાદ દ્વારા કૃષિ સંશોધન કેન્દ્ર, સણસોલી ખાતે બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં મહેમદાવાદ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ૭૦ ખેડૂતો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ (મહેમદાવાદ); શ્રી રમેશભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ (મહેમદાવાદ); ડૉ. બી. એન. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક અને કચેરીના વડા; ડૉ. જે. કે. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક; પ્રો. એમ. બી. ઝાલા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક; પ્રો. એસ. એ. સિપાઈ, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી; શ્રી ધવલભાઈ આર. પટેલ, મદદનીશ ખેતી નિયામક (મહેમદાવાદ); ડૉ. એસ. એચ. પટેલ, પશુચિકિત્સક અધિકારી (મહેમદાવાદ); શ્રી ડી. એન. પટેલ, બાગાયત અધિકારી (નડિયાદ) તથા મહેમદાવાદ તાલુકાના વિસ્તરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય તથા પધારેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને કરાઈ હતી. ડૉ. બી. એન. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રીએ આમંત્રિત મહેમાનો તથા પધારેલ ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કેન્દ્ર ખાતે ચાલતી સંશોધન, બીજ ઉત્પાદન અને વિસ્તરણની પ્રવૃત્તિઓથી ખેડૂતોને અવગત કર્યા હતા. મહેમદાવાદ તાલુકાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણે અતિથિ વિશેષ પદેથી પ્રાસંગિક ઉદબોધન તથા “ખેડૂત એ જગતનો તાત તથા ખેતીએ મહત્વનું ધંધાકીય સાધન” વિશે વિસ્તૃત ચિતાર આપ્યો હતો. વધુમાં, તેઓશ્રીએ ખેડૂતોને ખેતીની સાથે સાથે પશુપાલન પણ એક વ્યવસાય તરીકે અપનાવવું અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું તે માટે સંલગ્ન અધિકારીઓના સતત સંપર્કમાં રહેવાની સલાહ આપી હતી. મહેમદાવાદ તાલુકાના તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ ચૌહાણે યુવાનો કૃષિ ક્ષેત્રે સહભાગી બને તેવી અપીલ કરી હતી તથા મિશ્રખેતી કરવાની ભલામણ કરેલ. શ્રી ધવલભાઈ આર. પટેલ, મદદનીશ ખેતી નિયામક (મહેમદાવાદ) એ ગુજરાત સરકારની કૃષિ સંલગ્ન વિવિધ યોજનાઓ અને ખાસ કરીને “નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર” યોજના વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. મહેમદાવાદ તાલુકાના પશુચિકિત્સક ડૉ. સ્નેહલભાઈ પટેલે ખેડૂતોને મુંજવતા પશુપાલન અંગેના રોજબરોજના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. પ્રો. એમ. બી. ઝાલા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે “દિવેલામાં પાક સંરક્ષણ” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપેલ. ડૉ. જે. કે. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રીએ દિવેલામાં પાક સુધારણા અને પાક સંવર્ધન વિષય પર વિસ્તૃત ચર્ચા કરેલ. પ્રો. એસ. એ. સિપાઈએ “કૃષિક્ષેત્રે પડતી મુશ્કેલીઓ તથા તેના નિવારણ માટેના જરૂરી પગલા” વિશે વ્યાખ્યાન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે શ્રી વલ્લભભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી (મહેમદાવાદ) એ આભારવિધી કરી હતી. તાલીમના અંતે પ્રો. એમ. બી. ઝાલા એ પધારેલ ખેડૂતોને કેન્દ્ર તથા સીડ પ્રોડકશન ફાર્મની મુલાકાત કરાવી હતી.

# કાર્યક્રમની ઝાંખી

